

જાવક નંબર:- 5350

સરક્યુલર નંબર:- સી.ઈ. ૩ / ૨૦૨૧

તારીખ:- ૨૦/૦૬/૨૦૨૫..

અગત્યનું

(For Internal Circulation only)

પ્રતિ, શ્રી શાખા મેનેજર ગ્રેડ ૧/૨,

१॥५॥.

વિષય ::- નોનફાર્મ ધિરાણ ફ્લોટિંગ / ફિક્સ વ્યાજદરોમાં કરવામાં આવેલ ફેરફાર અંગે..

બેંક તરફથી નોનફાર્મ યોજના અન્વયે નીચે મુજબના ધિરાણ કરવામાં આવે છે. આ ધિરાણોના ફ્લોટિંગ / ફિક્સ વ્યાજ દરો જે-તે યોજના અનુસાર નીચે જણાવ્યા અનુસાર તા.૨૨/૦૬/૨૦૨૫થી અમલમાં આવશે.

નવા વ્યાજ દર તા.૨૨/૦૬/૨૦૨૫થી આપવામાં આવેલ નવા ધિરાણોમાં જ લાગુ પડશે.

અ. નં.	ધિરાણનો પ્રકાર	ધિરાણની મર્યાદા	Revised ૨૨/૦૬/૨૦૨૫થી ફુલોટિંગ નવો વ્યાજદર	Revised ૨૨/૦૬/૨૦૨૫થી ફિક્સ નવો વ્યાજદર	માસિક હપ્તા (મહત્તમ મર્યાદા)	માર્જિનના ટકા
#1	#2	#3			#5	#6
(૧)	(૧) મકાન બાંધકામ/ખરીદી (શહેર) તથા ઓડા ગુડા વિસ્તાર રહેણાંક (૨) મકાન બાંધકામ/ખરીદી (તાલુકા) રહેણાંક (૩) મકાન બાંધકામ/ખરીદી (ગ્રામ્ય) રહેણાંક	૭૫,૦૦,૦૦૦ ૩૦,૦૦,૦૦૦ ૧૦,૦૦,૦૦૦	૭.૪૫% થી ૮.૦૦%	૮.૬૦% થી ૮.૦૦%	૨૪૦ હપ્તે	૧૫ થી ૨૫%
(૨)	(A) કાર લોન (અંગત વપરાશ) (B) ઇલેક્ટ્રીક કાર લોન (અંગત વપરાશ) (ખાનગી)	૬૦,૦૦,૦૦૦	૭.૭૦% થી ૮.૮૦%	૮.૦૦% થી ૧૦.૦૦%	૮૪ હપ્તે	૨૫%
	(C) ભાડાના વાહન— સી.એન.જી. રીક્ષા કોર વ્હીલર નાના વાહનો/મોટા વાહનો	૧,૦૦,૦૦૦ ૬૦,૦૦,૦૦૦	— ** ૧૦.૦૦% થી ૧૩.૦૦%	— ** ૧૧.૦૦% થી ૧૩.૦૦%	૪૮ હપ્તે ૮૪ હપ્તે	૧૦% ૩૦%
	(D) ટુ-વ્હીલર લોન (હેડઓફિસ ખાતે)	૧૦,૦૦,૦૦૦ સુધી	** ૮.૫૦% થી ૧૧.૦૦%	** ૧૧.૦૦% થી ૧૨.૦૦%	૬૦ હપ્તે	૩૦%
	(E) ઓલ્ડ કાર (વેલ્યુએશન મુજબ) મહત્તમ પાંચ વર્ષ સુધીની ખરીદેલ કાર પર	૫,૦૦,૦૦૦ સુધી	૧૪.૫૦% થી ૧૫.૫૦%	૧૧.૦૦% થી ૧૨.૦૦%	૬૦ હપ્તે	૫૦%
(૩)	સિક્યોરિટી લોન:- ધંધાના પુરાવા + મિલકત મોર્ગેજ ગ્રામ્ય વિસ્તાર તાલુકા વિસ્તાર (ઓડા તથા ગુડા)	૧૦,૦૦,૦૦૦ ૧૫,૦૦,૦૦૦ ૩૦,૦૦,૦૦૦	** ૮.૨૫% થી ૮.૫૦%	** ૧૦.૫૦% થી ૧૧.૫૦%	૧૮૦ હપ્તે	વેલ્યુએશનનાં ૬૦%
	ખેડુતો તથા નોકરીયાત વર્ગ માટે (મિલકત મોર્ગેજ) નોંધ :- ખાસ સંજોગોમાં રૂ. ૧૫/- લાખ સુધીનું ધિરાણ કરી શકાશે.	૧૦,૦૦,૦૦૦	** ૮.૨૫% થી ૮.૫૦%	** ૧૦.૫૦% થી ૧૧.૫૦%	૧૨૦ હપ્તે	વેલ્યુએશનનાં ૬૦%
(૪)	(A) એડીસી વેપાર સાથી (ટર્મ લોન) પ્લાન્ટ / મશીનરી / ફર્નિચર / ઇક્વિપમેન્ટ	પોપરાઈઝરશીપ, પાર્ટનરશીપ કર્મ, તથા વ્યક્તિગત જેમાં (ફક્ત ડોક્ટર, વોકોલ, CA તથા પ્રોફેશનલ) માટે તથા LLP માટે 50/- લાખ સુધી પબ્લીક લી. / પ્રાઈવેટ લી.	* ૮.૦૦% થી ૧૧.૦૦%	* ૧૧.૦૦% થી ૧૨.૦૦%	ટર્મ લોન ૩૬ થી ૮૪ માસ માટે	૩૦% માર્જિન
	ધંધાકીય મિલકત ખરીદવા (સ્થાવર મિલકતના કિસ્સામાં ગ્રામ્ય વિસ્તારમાં ₹૧૦/- લાખની મર્યાદા રહેશે)	રજીસ્ટર્ડ કં. (Incorporate Body) ₹૨/- કરોડ સુધી			સ્થાવર મિલકત માટે ૨૪૦ માસ	૨૦% માર્જિન સ્થાવર મિલકત
	(B) એડીસી વેપાર સાથી કેશક્રેડિટ વાર્કિંગ કેપીટલ	પોપરાઈઝરશીપ, પાર્ટનરશીપ કર્મ, તથા વ્યક્તિગત જેમાં (ફક્ત ડોક્ટર, વોકોલ, CA તથા પ્રોફેશનલ) માટે તથા LLP માટે 50/- લાખ સુધી પબ્લીક લી. / પ્રાઈવેટ લી. રજીસ્ટર્ડ કં. (Incorporate Body) ₹૨/- કરોડ સુધી	૧૦.૫૦% થી ૧૨.૦૦%	૧૧.૦૦% થી ૧૨.૦૦%	કેશક્રેડિટ ૧૨ માસ માટે રિવ્યુ તથા રિન્યુઅલ માટે હે.ઓ. ખાતે મોકલવી.	* અરજી ફોર્મના પાના નં: ૧૭ મુજબ ગણતરી બાદના સ્કેકના ૭૫% અથવા * વાર્ષિક ટર્નઓવરના ૩૦% અથવા વેલ્યુએશનના ૮૦%
(૫)	ઉચ્ચ શિક્ષણ	૨૫,૦૦,૦૦૦	૭.૮૦% થી ૮.૦૦%	૮.૦૦% થી ૧૦.૦૦%	અભ્યાસના સમય પછી ૭ વર્ષ	ફી ના ૨૦% માર્જિન તથા વેલ્યુએશનના ૨૦% માર્જિન

અ. નં.	ધિરાણનો પ્રકાર	ધિરાણની મર્યાદા	Revised ૨૨/૦૬/૨૦૨૫થી ફ્લોટિંગ નવો વ્યાજદર	Revised ૨૨/૦૬/૨૦૨૫થી ફિક્સ નવો વ્યાજદર	માસિક હપ્તા (મહત્તમ મર્યાદા)	માર્જિનના ટકા
(૬)	એડીસી ટ્રેડસ ઓવર ડ્રાફ્ટ (મિલકતમોર્ગેજ સાથે) નોંધ :- ખાસ સંજોગોમાં રૂ.૧૫/-લાખ સુધી આપી શકાશે.	૧૦,૦૦,૦૦૦	* ૧૦.૫૦% થી ૧૨.૦૦%	* ૧૧.૦૦% થી ૧૨.૦૦%	૧૨ માસ માટે રિવ્યૂ તથા રિન્યુઅલ માટે હે.ઓ. ખાતે તમામ વિગતો સાથે મોકલવાની રહેશે.	* અરજી ફોર્મના પાના નં: ૧૪ મુજબ ગણતરી બાદના સ્ટોકના ૭૫% અથવા * વાર્ષિક ટર્નઓવરના ૩૦% અથવા વેલ્યુએશનના ૮૦%
(૭)	પંધાકીય ઓવરડ્રાફ્ટ (મિલકત મોર્ગેજ સાથે) (ઔદા તથા ગુણ સહિત) શહેરી વિસ્તાર ⇨ તાલુકા વિસ્તાર ⇨ ગ્રામ્ય વિસ્તાર ⇨	૬૦,૦૦,૦૦૦ ૩૦,૦૦,૦૦૦ ૧૦,૦૦,૦૦૦	* ૧૦.૫૦% થી ૧૨.૦૦%	* ૧૧.૦૦% થી ૧૨.૦૦%	૧૨ માસે રિવ્યૂ તથા ૩૬ માસે રિન્યુઅલ માટે હે.ઓ. ખાતે તમામ વિગતો સાથે મોકલવાની રહેશે.	માર્જિન ૪૦% વેલ્યુએશનના ૬૦% નોંધ :- ઔ. ડ્રા. ની રકમનો માપદંડ બેંકની પોલિસી મુજબનો રહેશે.
(૮)	મકાન રિપેરીંગ:- રહેણાંક ⇨ કોમર્શિયલ ⇨	૮૮,૦૦૦ ૮૮,૦૦૦	— —	૧૦.૦૦% થી ૧૦.૮૦%	૮૪ હપ્તે ૮૪ હપ્તે	૨૫% ૨૫%
(૯)	(અ) ગવર્નમેન્ટ સ્પોન્સર સ્કીમ — બેન્કેબલ બાજપાઈ યુવા રોજગાર, — બાજપાઈ બેન્કેબલ યોજના શહેરી ટેક્ષી સેવા (CNG) — દલ્તોપંત ડેંગડી કારીગર વ્યાજ સહાય યોજના તથા તમામ ગવર્નમેન્ટ સ્પોન્સર સ્કીમ પીએમ વિશ્વકર્મા યોજના વિવિધ વારસાગત કારીગરો માટે (બ) — સેલ્ફ હેલ્પ ગ્રુપ — જોઈન્ટ લાયબીલીટી ગ્રુપ (JLG)	૧,૦૦,૦૦૦ ૫,૦૦,૦૦૦ ૧,૦૦,૦૦૦ ૧,૦૦,૦૦૦ ૩,૦૦,૦૦૦ ૫,૦૦,૦૦૦	— — — — — —	૧૧% ૧૧% ૧૧% ૫% ૧૧% ૧૧%	૬૦ હપ્તે ૬૦ હપ્તે ૬૦ હપ્તે ૧૮ હપ્તે ૩૬ હપ્તે ૬૦ હપ્તે	૨૫% (લેસ સબસીડી)
(૧૦)	ગૃહ વપરાશના સાધનો ખરીદવા	૮૮,૦૦૦	૧૦.૫૦% થી ૧૩.૦૦%	૧૨.૦૦% થી ૧૪.૦૦%	૬૦ હપ્તે	૨૫%
(૧૧)	જાત-જામીનગીરી લોન (પસનલ લોન):-	૮૮,૦૦૦	૧૦.૫૦% થી ૧૩.૦૦%	૧૨.૦૦% થી ૧૪.૦૦%	૬૦ માસ	
(૧૨)	રિઝર્વ બેન્ક રીલીફ બોન્ડ તથા એન.એસ.સી. અને કે.વી.પી. (શાખા લેવલે ૨ લાખ સુધી) (ઓવરડ્રાફ્ટ કે મુદતી ધિરાણ)	૧૦,૦૦,૦૦૦	—	૮%	બોન્ડના સમય મુજબ + પાકતી મુદત સુધી	૧૫% ૩૦%
(૧૩)	રહેણાંક ઉપર સોલાર પ્લાન્ટ નાંખવા અને સ્વયંના વપરાશ કરવા માટે (DOMESTIC PURPOSE) સોલાર વોટરહીટર/સોલાર રૂફટોપ પેનલ લગાવવા	મહત્તમ મર્યાદા ૧૦,૦૦,૦૦૦	-	* ૮.૫૦% થી ૧૦.૦૦%	૮૪ માસ	૧૦% થી ૨૫%
(૧૪)	એ.ડી.સી. બેંક સરલ કેશ ક્રેડીટ યોજના	૧,૦૦,૦૦૦	-	૧૩%	૧૨ માસે રિવ્યૂ તથા ૩૬ માસે રિન્યુઅલ માટે હે.ઓ. ખાતે તમામ વિગતો સાથે મોકલવાની રહેશે.	૧% P/Fees

નોંધ :-

- નોનફાર્મ ધિરાણના તમામ પ્રકારના ખાતામાં પ્રોસેસીંગ ચાર્જ ૦.૧૫% થી ૦.૩૫% લેખે વસૂલ કરવાનો રહેશે. (JLG/Govt. Sponsored schemeમાં પ્રોસેસીંગ ચાર્જ લાગુ પડશે નહીં)
- શાખા પ્રબંધકને ખાસ સૂચના આપવામાં આવે છે કે જે લોન ખાતા મોર્ગેજ/હાઈપોથેકેશન લેવામાં આવેલ છે તેવા તમામ ખાતાઓનું વાર્ષિક ઈન્સપેક્શન કરી ઈન્સપેક્શન રજીસ્ટરમાં નોંધ કરવી તથા ઈન્સપેક્શન રિપોર્ટ લોનની ફાઈલમાં રાખવો. (ઈન્સપેક્શન કરવું ફરજિયાત છે.)
- કોષ્ટકના અનુક્રમ નંબર :- ૪, ૬, ૭ માં રિન્યુઅલ સમયે જે વ્યાજ દર હશે તે વ્યાજ દરથી રિન્યુ કરવામાં આવશે.
- જે ખાતેદારોએ હાલમાં ફિક્સ વ્યાજદરે ધિરાણ મેળવેલ છે, તેઓને નવા ફ્લોટિંગ વ્યાજદર સ્વીકારવાનો વિકલ્પ આપી શકાશે. તે માટે આ અંગેના પરિપત્ર જાવક નંબર ૨૧૭ તા.૧૨/૦૪/૨૦૨૪ મુજબ કાર્યવાહી કરવી.
- હાઉસીંગ લોનમાં લોનની મુદત પહેલા એટલે કે એડવાન્સ રીપેમેન્ટ એક વર્ષ દરમિયાન બાકી રકમના ૨૫%થી વધુ ભરી શકાશે નહીં. હાઉસીંગ લોનના ખાતાઓ સિવાય લોન ખાતામાં લોનની મુદત પૂરી થતા પહેલા લોન સંપૂર્ણ ભરપાઈ થવાના કિસ્સામાં પરિપત્ર જાવક નંબર ૨૧૭ તા.૧૨/૦૪/૨૦૨૪ મુજબ કાર્યવાહી કરવી.
- તમારા લેવલે લોન પેપર્સ, અવેબિલિટી, સીબીલ રિપોર્ટ અને રિપેરીંગ કેપેસિટી ચેક કરી વ્યાજદરની ભલામણ કરશો. ગ્રાહક સાથે ફાઈનલ વ્યાજદર, માર્જીન, લોનની રકમ, પ્રોસેસીંગ ફી તથા અન્ય શરતો હેડઓફિસથી મંજૂર કરવામાં આવશે.
- લોન ખાતામાં ચેક રિટર્ન / ECS રિટર્ન ચાર્જ રૂ.૨૦૦/- + GST વસૂલવાનો રહેશે.
- ઓવરડ્રૂ રકમ ઉપર ૨% પેનલ્ટી લેવાની રહેશે.
- પંધાકીય હેતુસરના ધિરાણો પૈકી રૂ.૨૫,૦૦૦/-ની મંજૂર રકમ સુધીના ધિરાણોને સ્વ-રોજગાર ક્રેડિટ કાર્ડ (SCC) / જનરલ ક્રેડિટ કાર્ડ (GCC) અન્વયે ગણવાનું રહેશે.
- સરલ કેશ ક્રેડીટ યોજનામાં ૩૦/૦૮/૨૦૨૫ સુધી પ્રોસેસીંગ ચાર્જ લેવાનું નથી.

ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર

નકલ રવાના :- તમામ વિભાગ